

IIT-Gnમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે આજે મેન્ટોર કોન્કલેવ

સિટી રિપોર્ટર  @ahm_cb

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-ગાંધીનગર દ્વારા ધોરણ 9થી લઈને 12મા ધોરણ સુધી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ આપવા માટે 'મેન્ટોર કોન્કલેવનું' આયોજન પાલેજ કેમ્પસ ખાતે શનિવારે કરાયું છે. સવારે 9 વાગ્યાથી શરૂ થનારા આ પ્રોગ્રામ માટે 200 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓનો કરિયર ગોલ અને વિઝન 9માં ધોરણથી જ ક્લિયર થઈ જાય તેના માટે આઈઆઈટી દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. આ અંગે આઈઆઈટી ગાંધીનગરનો સ્ટુડન્ટ કુશાગરા ભાર્ગવા કહે છે કે, 'ગ્લોબલ લેવલ પર જોવા જઈએ તો ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ હાલ ખૂબ ખરાબ હાલતમાં છે. જેને વિશ્વકક્ષાની બનાવવા માટે સ્કૂલ લેવલથી પ્રયાસ હાથ ધરવાની જરૂર છે. તેના સોલ્યુશન માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.'